



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા ૩૧/૦૭/૨૦૧૯ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૮૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૭ કેસ કરી, ૪૧ વ્યક્તિઓને ઝડપી, ૧૧૪ લીટર દેશી દારૂ, ૭૫ બોટલ ઈંગ્લીશ દારૂ, ૪ બિયર ટીન, ૧ કાર અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી, ૧૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૧,૦૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૮૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૩૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૨૮૮/૧૯

**નરોડા:** પ્રદીપભાઈ બાબુલાલ અગ્રવાલ (રહે. રૂઢાક્ષ બગ્લોઝ નારાયણી ફાર્મ પાસે એપોલો હોસ્પિટલ પાસે ભાટ ગાંધીનગર) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે આરોપી (૧) જ્યોત્સના બબલુદાસ દાસ (રહે. ઉતરપરા, કામડેકાતી, ડેગાંન્ગા નોર્થ ૨૪ પરગણા વેસ્ટ બંગાલ) અને (૨) દીનેશ ખંડેલવાલ (રહે. યુનીક મારબલ તીથાગઢ કોલકત્તા) એ ભેગા મળી પ્રદિપભાઈ ની નરોડા જીઆઈડીસી પ્લોટ નંબર-૧૩૬/૧ શેડ નંબર એફ/એફ/૯ ફેઝર મોર્ડન બેકરી રોડ પર આવેલ "ડાઇસ્ટ્રી" નામની કંપની ખાતે થી ડાઇજ નો માલ મંગાવી અલગ-અલગ તારીખના કુલ રૂપિયા ૨૫,૧૪,૩૪૪/- ની રકમના ચેકો આપતા, તે તમામ ચેકો બાઉન્સ થતા તે પેટે કોઈ ચૂકવણી નહીં કરી, પ્રદિપભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.જી.કામળીયા ચલાવે છે.

**વટવા:** સુષ્માદેવી વા/ઓ કિશનભાઈ સક્સેના (રહે. શ્યામપ્રસાદ મુખર્જીનગર ચાર માળીયા વટવા) એ તા.૩૦/૭/૧૯ નારોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે સને ૨૦૧૭ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી સંજયભાઈ કાડોરીલાલ રાઠોર (રહે.ગામ: મહરૂપુરખાર પોસ્ટ: જહાનગંજ થાના: ફતેહગઢ જીલ્લા: ફરૂખાબાદ ઉતરપ્રદેશ) એ વટવા સર્વે નંબર ૮૩૨ ની જમીન ઉપર આવેલ ઇન્દીરાનગરના નામે ઓળખાતી મિલ્કતમા આવેલ પ્લોટ નંબર-૭૬ ના મકાન ઉપર રૂપિયા ૫૦ ના સ્ટેમ્પ પેપર પર વેચાણ કરાર તથા જનરલ પાવર ઓફ એટર્ની લખી આપી, સુષ્માદેવી પાસેથી કુલ રૂપિયા ૫,૫૦,૦૦૦/- મેળવી લઈ, મકાન નહીં આપી સુષ્માદેવી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એમ.સાટીયા ચલાવે છે.

**કાગડાપીઠ:** રાજેન્દ્રકુમાર ભવરલાલ ગુંદેયા (ઉ.વ.૫૪)(રહે.જયવિલા બંગ્લોઝ વિહ્લપાર્ક સોસાયટી પાસે ગોરધનવાડી ટેકરા મણીનગર) એ તા.૩૦/૭/૧૯ નારોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૧૪/૦૨/૧૯ બપોરના ૩/૩૦ વાગ્યાના સુમારે કાંકરીયા આબાદ ડેરી સામે વિજય પ્લાઝા ખાતે આરોપી (૧) અનુપકુમાર વિશ્વનાથ જીદાલ અને (૨) મનોજકુમાર વિશ્વનાથ જીદાલ (બંને રહે. વિજય પ્લાઝા આબાદ ડેરી સામે કાંકરીયા) એ ભેગા મળી રાજેન્દ્રકુમાર ને છ ટ્રક વેચાણ પેટે રૂપિયા ૭,૦૦,૦૦૦/- તથા અન્ય ખર્ચાના રૂપિયા ૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭,૫૦,૦૦૦/- આપેલ હોવા છતા, આ ગાડીઓના લોન ભરપાઇ કરવા “ચોરામંડલ ફાઇનાન્સમા” પૈસા ભરીને રાજેન્દ્રકુમારને “હાયપોથીકેશન કેન્સલ લેટર” નહી અપાવતા, તા.૧૯/૦૬/૧૯ ના રોજ ફાઇનાન્સવાળા રાજેન્દ્રકુમારની છ ટ્રકો લઇ ગયેલ હોય, રાજેન્દ્રકુમાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એસ.રબારી ચલાવે છે.

**ચોરી:-**

**સમાચાર યાદી નં.૧૨૮૯/૧૯**

**વસ્ત્રાપુર:** દેવેન્દ્રકુમાર અમથાભાઇ દેસાઇ (ઉ.વ.૩૦) (રહે. ઉમીયાનગર તક્ષશિલા સ્કુલ પાછળ વસ્ત્રાલ રોડ) એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૨૯/૦૭/૧૯ બપોરના ૪/૦૦ થી ૫/૦૦ વાગ્યા દરમ્યાન સિન્ધુભવન રોડ ગોટીલા ગાર્ડનના મુખ્ય એન્ટ્રી ગેટની ડાબી બાજુ પાર્ક કરેલ પોતાના સ્ફૂટરની ડેકીમાંથી અજાણી વ્યક્તિએ મોબાઇલ ફોન નંગ-૨ કિમત રૂપિયા ૧૩,૦૦૦/-, રોકડ રૂપિયા ૨,૪૦૦/- તેમજ ડેબીટકાર્ડ અને જરૂરી દસ્તાવેજ ચોરી કરી ડેબીટ કાર્ડથી રૂપિયા ૪૫,૦૦૦/- ઉપાડી લીધા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.જે.ભાટીયા ચલાવે છે.

**ટ્રેઈનની અડફેટે મૃત્યુ:-**

**સમાચાર યાદી નં.૧૨૯૦/૧૯**

**જીઆઈડીસી વટવા:** અનિલકુમાર હરીદર ગોસ્વામી (ઉ.વ.૨૩) (રહે.દુર્ગાનગર ચાર માળીયા સામે વટવા) તા.૩૦/૦૭/૧૯ બપોરના ૨/૩૦ થી ૩/૦૦ વાગ્યા દરમ્યાન જશોદાનગર પુનિતનગર રેલવે ફાટક ખાતે રેલવેની અડફેટે આવી જતા ગંભીર ઈજાઓ થતા તેનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે જીઆઈડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એ.બી.રાહોડ ચલાવે છે.

**આત્મહત્યા :-**

**સમાચાર યાદી નં.૧૨૯૧/૧૯**

**સેટેલાઈટ:** મીલન કાંતીભાઇ બોરસાણીયા (ઉ.વ.૨૬) (રહે. યમુના પાર્ક સોસાયટી શ્યામલ ચાર રસ્તા પાસે સેટેલાઈટ) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૭/૧૯ બપોરના ૨/૨૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રાતના ૧૦/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે સેટેલાઈટ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી કે.ડી. રવિયા ચલાવે છે.

**નિકોલ:** રંજનબહેન ડો/ઓ કિર્તીભાઈ પંચાલ (ઉ.વ.૨૩) (રહે. અક્ષરધામ સોસાયટી વિરાટનગર કેનાલ પાસે નિકોલ) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૭/૧૯ કલાક ૪/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતના લોખંડના ટુકડામાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી રામસિંહ ચેહરસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.